



RAN-2508000605020001

T.Y.B.Com. (NCF - NEP Major) (Sem. - V) Examination October - 2025

Advance Accounting and Auditing Paper : 5

[Total Marks: 50

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book	Seat No.: <table border="1"> <tr> <td> </td> <td> </td> <td> </td> <td> </td> <td> </td> <td> </td> </tr> </table> Student's Signature						

- પ્ર. 1 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. (કોઈ પણ પાંચ) (10)**
- (1) ટીમીંગ અને લેડિંગ એટલે શું?
 - (2) મૂળભૂત વાઉચરો અને આનુષંગિક વાઉચરો એટલે શું?
 - (3) આંતરીક અંકુશના પ્રકારો જણાવો.
 - (4) નફો વધુ દર્શાવવાના કોઈ પણ બે કારણો જણાવો.
 - (5) સંભવિત જવાબદારીના કોઈ પણ ચાર ઉદાહરણ આપો.
 - (6) પ્રાયોગિક તપાસ એટલે શું?
 - (7) ભારતમાં પ્રાચીન ઓડિટીંગના કોઈ પણ બે હેતુઓ જણાવો.
- પ્ર. 2 કાચાંસરવૈયાને અસર કરતી ભૂલો અને અસર ન કરતી ભૂલો વિગતે જણાવો. (14)**
- અથવા**
- પ્ર. 2 (અ) પ્રાચીન ઓડિટિંગ અને આધુનિક ઓડિટીંગ વચ્ચેનો તફાવત આપો. (07)**
- પ્ર. 2 (બ) પ્રાચીન ઓડિટીંગની તકનિકો જણાવો. (07)**
- પ્ર. 3 વાઉચિંગ અંગે ઓડિટરની ફરજો જણાવી મિલકતોની ચકાસણી માટે ઓડિટરે ધ્યાનમાં રાખવાના સામાન્ય સિદ્ધાંતો જણાવો. (14)**
- અથવા**
- પ્ર. 3 (અ) નીચેનાની ચકાસણી અને મૂલ્યાંકન કેવી રીતે કરશો? (7)**
- (1) કરવેરા અંગેની જવાબદારી
 - (2) આકસ્મિક જવાબદારી
- પ્ર. 3 (બ) નીચેનાનું વાઉચિંગ કેવી રીતે કરશો? (7)**
- (1) કાયમી મિલકતોના વેચાણની આવક
 - (2) શેરમૂડી

- પ્ર. 4 ટૂંકનોંધ લખો. (ગમે તે ત્રણ) (12)
- (1) ચાલુ ઓડિટના લાભો
 - (2) ઓડિટીંગનું મહત્વ
 - (3) ઓડિટરના કામકાજ ના કાગળો
 - (4) ઓડિટ નોંધપોથી અને ઓડિટ કાર્યક્રમ વચ્ચેનો તફાવત
 - (5) આંતરિક અંકુશ અને આંતરિક ઓડિટ વચ્ચેનો તફાવત

ENGLISH VERSION

- Q. 1 write the following answer in short.(Any Five) (10)**
- (1) What is teeming and lading?
 - (2) What do you mean by Primary Voucher and Collateral Voucher?
 - (3) Enlist the types of Internal Control.
 - (4) State any two reasons for showing more profit.
 - (5) Give any four examples of contingent liabilities.
 - (6) What do you mean by Test Checking?
 - (7) Give any two purpose of ancient auditing in India.
- Q. 2 State the errors affecting and not affecting on Trial Balance. (14)**
- OR**
- Q. 2 (A) Difference between ancient auditing and modern auditing. (7)**
- Q. 2 (B) Give the techniques of ancient auditing. (7)**
- Q. 3 Discuss the auditor's duties regarding Vouching and state at the time of verification of Assets which general principles should be kept in mind by the Auditor. (14)**
- OR**
- Q. 3 (A) How to check and evaluate the following? (7)**
- (1) Liability for taxation
 - (2) Contingent liability
- Q. 3 (B) How to vouch the following. (7)**
- (1) Proceeds from sale of Fixed assets
 - (2) Share Capital
- Q. 4 Write a short note (Any any three) (12)**
- (1) Advantages of Continuous Audit
 - (2) Importance of Auditing
 - (3) working papers of auditors
 - (4) Difference between Audit Notebook and Audit Programme
 - (5) Difference between internal check and internal audit